

અસંદ શાસનના પતન બાદ ૧, ૧૫, ૦૦૦ જેટલા સીરિયાઈ નાગરિક વતન પરત આવ્યા : UN

યુદ્ધને કારણો તૂટેલા ફૂટેલા મકાનોમાં વસવાટ કરવા પાછા આવ્યા લોકો

(એજન્સી)

તા. ૪

સીરિયામાં અસંદ શાસનનું પતન થયું પછી અન્યાં કેવી વાગ્ય હૈ કે હજુ જેટલા નાગરિક વતન પરત આવ્યા હોયનું યુનો રેફ્યુઝન અભિન્ની દ્વારા જીએર કરવામાં આવ્યું છે. યુનો અહેવાલ જ્ઞાવે છે કે દેશ છોડીને એન્ન, તુર્કી અને લેબેનોન પછી ચો ગવેલા નાગરિક હું અને અસંદ શાસન ગયા પછી સીરિયાની પરત આવી ગયા છે. અને હજુ વધુ આવી રહ્યા છે. અભિન્ની દ્વારા સરહદ પરાના નિરીક્ષણાને યજીમાન દેશો પાસેથી મળેલી વિગતોના આપારે અને ઇમીશ્રેણના ઉયા જોયા પછી આવેના કર્યું છે.



સંયુક્ત રાષ્ટ્ર નિષ્ણાતોએ ગાઝામાં આરોગ્ય અધિકારો પર ઈજરાયેલના હુમલાની ટીકા કરી

(એજન્સી)

તા. ૪

યુનેનના નિષ્ણાતોએ ઘેરાયેલા પ્લેસ્ટીની પ્રેદેશમાં આરોગ્ય અધિકારો પરાના 'નિર્દ્ધિપ હુમલો'નો અંત વતન માં કરીને ઉત્તર જ્યારો જ્યારો એક પારિત હોસ્પિટલ પર ઈજરાયેલી દરોઝની ટીકા કર્યું છે. બે સ્વર્ગ યુનો રાષ્ટ્રસ નિષ્ણાતોએ, ઈજરાયેલ ગાઝામાં નરસહાલ કરી રહ્યું હોયાં આવેલોને મુનુરવાતિત કરીને ઉત્તર ગાઝામાં છેલ્લી કાર્યતત મુખ્ય હોસ્પિટલ કમ્પલ અદ્યાત્મન પર ગયા શુકવરના દરોઝાં 'ભયનક' છે. નિષ્ણાતોએ જ્ઞાવ્યું હતું કે, 'નરસહાલના એક વષ્ઠી વૃદ્ધ સમય પછી નાની બાબીના કલાજાયાના પેદેસ્ટીની પ્રેદેશમાં અધિકારો પર ઈજરાયેલોની પરિસ્થિત પર સ્વતંત્ર યુદ્ધના સ્પેશિયલ રેપોર્ટર અને સ્વાસ્થ્યના અધિકાર પર વિશેષ રેપોર્ટર તલાવેંગ મોકોંગનું હતું. જિનીયામાં ઈજરાયેલા રાજાદ્વારી મિલાજે નિષેદ્ધનું 'સંયુક્ત રાષ્ટ્ર નિષ્ણાતોએ ગાઝામાં આરોગ્ય અધિકારો પર ઈજરાયેલના હુમલાની ટીકા કરી' કર્યું છે.



વેસ્ટ બેંકમાં સુરક્ષા દળો સાથેના સંઘર્ષમાં ત્રણું પેદેસ્ટીનીઓનાં મોત

(એજન્સી)

તા. ૪

સ્થાનિક તથીબી અધિકારોએ શુકવારે જ્ઞાવ્યું કે, ઈજરાયેલા કલાજાયાના પેદેસ્ટીની વ્યક્તિને અને તેના પુરુષ મુખ્ય થયું છે. આ ઘટના ત્યારે આવી છે જ્યારે શરેરમાં પેદેસ્ટીની સુરક્ષા દળો અને સશરણ આંતંગાદી સમૂહોને વચ્ચે એક મહિનાથી સંખ્યા થયું છે. આ ઉપરાત, એક સુરક્ષા દળના અધિકારોનું મુખ્ય થયું છે, જેને પેદેસ્ટીની સંસ્કૃતિયાની પરિસ્થિતી (PA)ના અધિકારોએ જ્ઞાવ્યું હતું કે, જેનિનમાં પદ્ધતિયાની શરૂ થયેલા ગોપનીયમાં મુખ્ય પામેલ મહિનાનું કુલ સંખ્યા છ થઈ ગઈ છે. ત્યાં કોઈ વધુ વિષયો હતી. PAએ ઈન્ફર્મ કર્યો કે તેના દળોએ ૪૪ વષ્ય વિષય વિજીવાને અને તેના પુરુણે મારી નાય્યા છે, જેનિન શરાબાની શિબિરમાં તેમના ઘરની છત પર ઉત્તા હતા ત્યાં વિષયિત ગાયની હતી, જે એક ઘેરાયેલી વિષયાની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટના ત્યારે આવી છે જ્યારે શરેરમાં પેદેસ્ટીની સુરક્ષા દળો અને સશરણ આંતંગાદી સમૂહોને વચ્ચે એક મહિનાથી સંખ્યા થયું છે. આ ઉપરાત, એક સશરણ જેનિનમાં આંતંગાદી સમૂહોને પદ્ધતિયાની પરિસ્થિતીની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોનું કેર્લેન્ડ હું હતું કે, જેનિન અને તેણું વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોને પદ્ધતિયાની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોનું કેર્લેન્ડ હું હતું કે, જેનિન અને તેણું વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે.



ઇજરાયેલી સેનાએ ગાઝાની ઈન્ડોનેશિયન હોસ્પિટલ પર હુમલો કર્યો, તેને ખાલી કરવાનો આદેશ આપ્યો

(એજન્સી)

તા. ૪

પેદેસ્ટીનિયન ઈન્ડોનેશન સેન્ટરના અંતરાત્મા જ્ઞાવ્યા છે કે, ઈજરાયેલી કલાજાયાના દળોને આજે ઉત્તર જ્યારો નાગરિકોની ઈન્ડોનેશિયન હોસ્પિટલની હુમલો કર્યો, તેના તથીબી કર્મચારીઓને દર્દીઓને કથી આપ્યો અને તેને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો. માર્ટીયાની જ્યાવાના અનુસાર, હોસ્પિટલ હવે ઈજરાયેલી દળો દ્વારા બાંધુત્વ અને પદ્ધતિયાની પરિસ્થિતાની અનુભૂતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનાની વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોને પદ્ધતિયાની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોનું કેર્લેન્ડ હું હતું કે, જેનિન અને તેણું વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે.



અને વીજાણી વિભાગો પણ નાશ કર્યો, જેનાથી મહત્વપૂર્ણ તથીબી સેવાઓ પૂરી પાડવી અશક્ત બની ગઈ, આરોગ્ય સુવિધા પર હુમલો કર્યો એ હોસ્પિટલની જ્યાવાના અનુસાર, વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોને પદ્ધતિયાની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે. એવા ઘટનામાં આંતંગાદી સમૂહોનું કેર્લેન્ડ હું હતું કે, જેનિન અને તેણું વિષયોની પરિસ્થિતિની અનુભૂતિને પ્રદાન કરી રહી છે.

'ઓપરેશન મેની વેઝ': કેવી રીતે ઈજરાયેલી દળોએ સીરિયામાં ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સુવિધાની નાશ કર્યો

(એજન્સી)

તા. ૪

ઇજરાયેલી સેનાએ ગુરું પૂરું પાડવામાં આવેલ સુવિધાની વિગતો જાહેર કરી હતી. સીરિયામાં કિથિન ભૂગર્ભ મિસાઈલ ઉપયોગને નાશ કરવા માટેની ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું હતું. 'ઓપરેશન મેની વેઝ' નામનું આ પિશિને ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ રોજ પદ્ધતિમાં સીરિયામાં ૧૨૦ ઈજરાયેલી ક્રાસ્ટ્રેન હું હતું. એપરેશન મેની વેઝ કાઢી કરી શકીએ છીએ: ગ્રાના સાટેબરમાં હું હતું. આ ઓપરેશન ઈર

છીસ નોંધ
લોકોની સેવા કરવી તે શ્રેષ્ઠ
નેકી છે.

-હિન્દીસ બોધ

નોંધ કચન
ભવિષ્યના સામાજિકો
બુઝિના સામાજિક હોઝ.
-વિન્સટન ચર્ચિલ

આજની આરતી
૫ જુનુંઅની રવિવાર ૨૦૨૪
૪ રજની ડિજિટી ૧૪૩૫
પોંસ સુદું ચિક્કું સંવાદ ૨૦૨૧
સુહું સાહિક ૫-૫૭
ખરેણ જાલ ૧૨-૪૫
દુષ્ટોને આકાશ (સુર્યોદાય) ૮-૨૨
દુષ્ટોને આકાશ (સુર્યોદાય) ૮-૧૮

વિશ્વાસિક વિવાન શાયર 'અલ્લામા ઇકલાબ' કોઈ પરિચયના મોષાલજન
નથી... એમણે દાયકાંનો પહેલું જે લખ્યું છે એ આજે પણ બેટદું જ
પ્રાર્વિક છે ત્યારે તેમના દિવસીઓની છાલાબદ અની હિન્દુની રચનાઓને
અર્થી સરળ ગુજરાતીમાં ભાવાનું સાથે સમાજાવનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુલામદ ઇકલાબની શાયરી / ભાવાનું

અય દોસ્ત કણે હિંમત કુછ દૂધ સરેરા હૈ,
ગર ચાહેલ હો મંજિલ તા પચાણ બદલ ડાલો
યુવાનને સંબોધન છે કે તારી મંજિલ નજીક જ છે, તુંડિન બદલી
દે. કંઘચિદ્ગ મેળવા જરૂર પડે તો તારી કાંઈ બદલી નાખ.
સમય, સંજીવ પારનું ઘણાંનિ કર, વિપરીણ સંજીવોનું પણ હિંમત
હાયે વિના તારા ધ્યેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, અલ્લાહ અવશ્ય
કામિયાની આપ્યે.

- (ભાવાનું કરતી અલ્લામદહુસેન સોચ)

અંગતની સુધીના

આ આખારામાં જરૂરિયાને આનુભૂતીની શરીરો ઉદ્યોગ,
ફિલો કેટલીકિરાવ ધ્યાપા પડે છે, જે વાયકનોની ધારાને આવે તો
તેની તેમણે ખાસ હિક્કન કરવી.

- વિવસ્થાક

દિલ્લો ૫૨ અત્યારાર મુદ્દે સેલજના માર્જિ ૫૨ પ્રાંતી

(અનુભૂતિ) ચંદ્રાગ, તા. ૪

AICC મહાસચિવ અને
સિરસા સંસંદ્ર કુમારી સેલજાને
દિલ્લીના 'દાન' માટે કેન્દ્ર તેમજ
રાજ્યાંમાં ભાજી સંચિત
સરકારની ટીકા કરી હતી.
સેલજાને કર્યું કે હરિયાલી અને
બોડીસ સાચિત અથ રાજ્યાંમાં
તાજેતરાના દિલ્લી મહિલાનો પર
બજારની કાંઈ ધ્યાપાની વાંચી છે, આ
રાજ્યોને દિલ્લીના સામે અત્યારાના
આંગનો પાંચો માટે સુરક્ષિત
આપણસાંનો ફેરાઈ જ્યાએ.



તે મણે કર્યું, 'અંગતાના દિલ્લીના
સુધીના પાંચાં સંસાધાનોને આપાય
છે, દિલ્લીનો માટે ભારતીય
બંધાસાંમાં સમાવિષ લોકતાનિક

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને આપાય
છે, દિલ્લીનો લગ્બા તુલા હતું, જે વિના
કર્યાનો કર્યાનો હતું, અને

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

અંગતાની દોસ્તી પાંચાં સંસાધાનોને

આપાય છે, દિલ્લીનો લગ્બા

હતું, અને અંગતાની દોસ્તી

ના

<p

૨૩૦ રોકાણકારોનું ૨૫ લાખથી રૂ.૪ કરોડ સુધીનું રોકાણ BZ શ્રુપના કરોડોના કૌભાંડના આરોપી જાલાની વધુ તપાસ બાકી હોય સાત દિવસના રિમાન્ડ પર

પોલીસ દ્વારા વધુ તપાસ માટેના મુદ્દા કોર્ટ સમક્ષ રજૂ કરાતા વધુ રિમાન્ડની માંગ સ્વીકારાઈ

(સંવાદાતા દ્વારા)

અમદાવાદ, તા.૪

ગુજરાતના ડિમનગરમાં પોન્ઝો સ્ક્રીમ ચલાવી હોય, ૬,૦૦૦ કરોડનું કોંગ્રેસની આયા રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારાબાદ આજે રિમાન્ડ પૂર્ણ થતું CID કોર્ટે ખૂબેં જાલાની એન્ના આયાવાદ પ્રાચ્ય કોંગ્રેસની રિમાન્ડની માગ કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારાબાદ આજે રિમાન્ડ પૂર્ણ થતું CID કોર્ટે ખૂબેં જાલાની એન્ના આયાવાદ પ્રાચ્ય કોંગ્રેસની રિમાન્ડની માગ કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.



અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારાબાદ આજે રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અમદાવાદ ગ્રામ સેન્ટ્રન્સ

કોન્ટાક્ટ સરકારી વિશે પ્રવાલી

નિર્ણયાંથી રિમાન્ડ માગતાની કોર્ટ સમય રજૂઆત કરી હતી. કોંગ્રેસ બાંધું દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

યોજનામાં થઈ રહેલા કૌભાંડોને લઈ ગુજરાત સરકાર એકિટ્વ મોડમાં!

PMJAY કર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગેરરીતિ બદલ અનેસર કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો આરોગ્ય વિભાગને મોકાલી શક્ષાં : બ્લોટસેપ નંબર જાહેર

(સંવાદાતા દ્વારા)

અમદાવાદ, તા.૪

પોઅમજેલાય યોજાનમાં

સતત થઈ રહેલું કોંપનીને

પગલે ગુજરાત સરકાર એકિટ્વ

બની છે. વિગતો

એકિટ્વ બની એન્સ્સર

ગેરરીતિ આયતન થઈ અજાન્સી

બદલાઈ ગઈ છે. વિગતો સુધુભા

નિર્ણયાંથી રિમાન્ડ

પારોગ્ય

એકિટ્વ બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બની એકિટ્વ

બન

સખત મહેનતથી અશક્યને શક્ય કરી શકાય. જણો ડિલિવરી
બોયમાંથી ન્યાયાધીશ બનનાર કેરળના યુવકની પ્રેરણાદાયી વાત



એક સમયે મોડી રાત સુધી શહેરની ગલીઓમાં ફૂડ ડિલિવરી કરનાર યાસીન શાન મુહુમ્મદે કેરળ સ્ટેટ જ્યુડિશિયરીની એકગ્રામ બીજા ક્રમે પાસ કરીને મહેનતનો કોઇ શોર્ટકટ નથી અને સપના પૂરા કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તે ભાબતને સાંભિત કરી દીધી હતી. બાળપણથી જ સંઘર્ષ વચ્ચે ઉછેરેલા યાસીન એડવોકેટ બન્યાના દોટ વર્ષમાં જ સિવિલ જજ બની ગયા. તેઓ અભ્યાસ સાથે ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. કોવિડ દરમિયાન કામ બંધ રાખવું પડ્યું હતું અને નાણાંની જરૂરિયાત હતી ત્યારે પર્સનલ લોન માટે પ્રયત્ન કર્યો પરંતુ મળી નહોતી. પરીક્ષાઓ નજુક આવી રહી હોવાથી તેઓ બીજું કામ પણ કરી શક્યા નહોતા. તેમના નજુકના મિત્રો સહિત ઘણા લોકોએ તેમને તેમના એલાએલબી દરમિયાન મુશ્કેલ સમય પાર કરવામાં મદદ કરી હતી.


મિત્રો હું હંમેશા કહેતો હોવ છું કે જો તમે કોઈ એક ધ્યેય
નક્કી કરી લો અને તેની પાછળ સખત મહેનત કરો તો તે
તમને મજા વગર રહે નહીં. કઢેવાળ ને કે જો તમે એક બાબતનો
મનમાં નિશ્ચય કરી લો અને તે તરફ મહેનત કરી તો લો તો
કૃદર પણ તમારી આંગનાં પકડીને સફળતાની સીધી ચાલવે
છે. આજે આપણે વાત કર્યા હું કે, કરેણા એક યુવકની કે જે
એક સમયે તિલિવરી બ્યુ તરીકે કામ કરીને પેટીયુ રહતા હતા
અને આજે કરેણા જીવુદીયરીની એકજામ પાસ કરીને સિવિલ
જજ જેવો પ્રતીક્રિયા હોય થારણ કર્યો છે. એવોકેટ પાસના
શાન મુહુરમદ કે જેઓ કરેણા ન્યારીક સેવાઓ પરીક્ષા ૨૦૨૪માં
બીજા કરે આવ્યા હતા અને સિવિલ જજ બનના માટે લાયક
બન્યા હતા તે બેઠેથી પ્રેરણાદારી છે. તેમના માટે આ સમગ્ર
સફળતા સહેલ્લો નહોંતી. પરંતુ મનમા ગાંઠ વાળી લીધી હડી
કે, તેઓને આ તરફ કારકિર્દી બાબતી છે અને અંતે તેઓને
સફળતા મળી છે. તો ચાલો આજે આપણે આજના અંકમાં
તેઓની જીવનની સફળતા અને તેની પાછળની સંઘર્ષ ગાથા
વિશે જાણીશું કારણ કે તેમનું ગુજરાત સાથે પણ એક સમયે
જાગા રહેલું છે.

યાસીનના બાળપણ વિત્યું ભારે સંઘર્ષમાં...

यासीन कर्तव्य पलकदंड जिल्हामा थे। तभी माताजे दृढ़ धोरणमां हता तारे शापा छोड़ी दीर्घी हती अने तेषाएँ १४ वर्षनी उम्रे लग्न करी लीचा हता अने १८ वर्षनी उम्रे छूटाछेड़ा लीचा हता। तेषीजे १५ वर्षनी हती तारे तेना प्रथम संतान यासीन जन्म आयो हतो। तेषो क्वारिये तेना पिता साथे कोई संपर्क कर्यो न हतो। एकली माताजे तेना बे बालको अने तेमनी दाढ़ीनी संलग्ना राजनी पठती हती। तेषी हैनिक वेतन माटे क्रम करती हती अने आशा वर्कर तरीके रोजगारी मेवनता हता। तेषीने गरीबों माटे राज्य सरकारना आवास योजना द्वारा परिवारने माथा पर छत मणी। एटेवे के मांड मांड सारं मकान मध्यु के जेणा माथभम्भी बेकूटि सुविधा सावे रही शकाय, यासीन ठेमेशा वपरायेला किपां पहेरता हता अने तेनी पासे पुस्तके खरीदवा माटे पक्ष पैसा नहोता। आर्थिक जूरियताने क्रांते मञ्जभूती लोवाची पोताना खर्यने पहोची वग्ना माटे तेमो नानपाली ज यासीने अभवार अने दृढ़

આપણાને લાગે કે સમય સરકતો જાય છે, હડીકતમાં તો આપણે જ સરકતા જઈએ છીએ. સમયને આપણે સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અથવાટિયું, પખવાટિયું, મહિનો, વર્ષ અને સદીમાં વહેંચી દીધો... સમયને સમયના જ ચોકડામાંથી બાંધી દીધો... પણ ભલા માણસ, જે યુગોથી સમસ્ત સૂચિને બાંધ્યો અને છોડ્યો રહ્યો છે એ કોઈનાયથી બંધાય ખર્ચો ??

द्वारा उत्तर देखा गया कि कानूनप्रवर्तन जल्दी हो।
द्वारा उत्तर देखा गया कि कानूनप्रवर्तन जल्दी हो।
कांडा परन्तु घडियाण बहुलवाची समय नथी ठिंगारी जता।
रीते घडियाणना कांटा अटकावा देता समय नथी अटकावानो।
क्षणोन्हे समाज ऐतरे समय। समयनो समाज विस्तृत छे।
समयने कोई सीमा नथी। समय तो अनांदानो अपाप्त छे,
जेने संभाव्य अने ज संभाव्य। समयनो संभाव्य पक्षा होय अने
समयना थाप्य पक्षा होय। समय सुंवालो पक्षा होय, ऊँझो
पक्षा होय अने.... कांटावो पक्षा होय। समय तो मेंशा आपाप्ता
बनीने आवे छे अने आपापो बनीने रहेवा मांगे छे, पक्षा ए
समय पहेलाना आपापा विचारी, अ समय पहेलाना आपापा



वर्तमान अने ए समय पहेलाना आपणा आपोजोनो जे समयने आपणो बनतां अवश्येचे छे. समय तो आपणो बनवा आतुर छे, पाणी आपणी जे कोई अधीक्षण एके असंयमी ठिक्काने करावे समय अने आपणी वच्ये एक अपकाश-एक शून्यावकाश भरी देता होइले शीअे. बापुभाई गढवाले, पोतामी अमरवत्पामेली अने शायरने अमर करी गयेली गजलवां, कवुं छे :

तमने समर नवी याने मारो समय नवी,
कोइ कहुं के आपणी वच्ये प्राण्य नवी;
कोइकी पासे समय नवी अने कोइक अबुं पाणी छे, जन्म-

હજુ સમય આવ્યો નથી - આ બંને સ્થિતિ ક્રાઈપ્લાન સંબંધિતી શાસ કાંતો શરૂ કરાવે છે, કાંતો અટકાવી દે છે.

આતુરોણા 'માસ્ક' પહેલીવાગ્યે આપણે સમયને શ્રીમત અને ગરીબ એવા વિનું વહેંચી દીખે. વસંતકાળનું સમયને આપણે શ્રીમતાના વર્ણાના અને પાનખરાત્રાનું આપણે ગરીબ વર્ણાનું મુક્કી સમયનો પણ 'એક સમય' હોય છે એવું દિલ અને દિમાગન સમજાવવાનું ખડુંયત ઊભું કરી દીકું. આવા પડુંયતકારીઓ જ એવું માનતા અને કહેતા રહે છે કે 'સમય તો

હિલિવરી બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તેના શાળાના અભ્યાસની સાથે તેના પરિવહને ટેકો આપ્યો. એવો સમય હતો જ્યારે તે મજૂર તરીકે બાંધકામ સાઈટ્સ પર કામ કરતા હતા. પરંતુ મનમાં એક સપણું લઈને ફરતા હતા અને તેના તરફ મહેનત પણ કરતા હતી.

જીએટી લીગલ વેબસાઇટ 'લાઈઝ લો', 'ધ પ્રિન્ટ' જેવા માધ્યમો થાએ શેર કરેલી ઉપરોક્ત માહિતી મુજબ યાસીન યાદ કરે છે કે તે તેના શાળાના દિવસોમાં સરેરાશી પણ એથું દેખાય કરી શકતા હતા. કારણ કે તેની પાસે અભ્યાસ પર ઘણ કેન્દ્રિત કરવા માટે પૂરો સમય નહોતો અને તેને માર્ગદર્શન આપનાર

હેલ્લો સ્ટુડન્ટ્સ

- સાહેબ સોની

કોઈ નહોતું. બારામા ધોરણ પદી, તેણે પોલિટેકનિક કોલેજમાંથી હેલ્લેક્યુનિવર્સિટીના ડિલ્યુના કોર્સ પૂર્ણ કર્યા. તે કરે છે કે ડિલ્યુના કોશલ્ય આધારિત અભ્યાસક્રમ હોવાથી તેને નોકરી શોખવાની વધુ તક મળે છે. તેમણે એક વર્ષ માટે ગુજરાતમાં નાની નોકરી કરી અને કેરળ પાણી કર્યા અને બી.આ.માં જાહેર વહીવટના વિષયમાં સ્નાતક થયા, તે પણી તેણો તેમના કાયદાકાર્ય શિક્ષણને આગળ ધારવા માટે નિશ્ચય કર્યો.

તેમણે રાજ્યની કાયદાની પરીવેશ પરિશ્વમાં છખમો કમ મેળવ્યો અને રાજ્યમાં પ્રતિભિત ગણતાની સરકારી લો કોલેજ, એન્સીક્લિબમાં પરીવેશ મેળવ્યો. તેમના એજ્યુયેશન દરમયાન તેમણે શાળાના બાળકો માટે ટ્યુશન કર્યા હતા અને એલ.એલ.બી. કોવિડ રોગયાણો ફેલાપો તાં મુશ્કી તેણે Zomato માટે ડિવિવરી બોય તરીકે કામ કર્યું.

માર્ચ ૨૦૨૦માં એડોકેટ તરીકે નોંધણી કર્મ પદી તેણે પહુંચું મુસ્નિક - મેન્ડિક્સ્ટ્રોટ્ટ ક્રોટ્ટામાં એડોકેટ શાહુવ હીંદ પીટાની જુનિપર વડીલ તરીકે તેમના કાર્યક્રમીના શરૂઆત કરી. રસપ્રદ વાત એ છે કે આ જ કાયદાલયના અન્ય બે વડીલો, એડ્વ શાહિના એન્નતી અને તેમના એન્નારૂપો ગાં ડેરાન ન્યાયિક પ્રેતા પાતીશાખાનો

પાસ કરી હતી અને તેઓએ તેમને પરીક્ષાની તેથારી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કેવી રીતે પરીક્ષાની કરી તોયારીઓ?
 ૨૬ વર્ષના યાસીનને સુખ યાદ છે કે રેશમા જેવા વરિષ્ઠ
 અને શાહુલ હમીટ તેમને ખૂબ મદદ કરી કરાણ કે તેમને રોંગિંડા
 કોટના કામ વચ્ચે યોગ્ય માળંદરન અને તક મળી. તેમના ઉપરાંત
 શિક્ષક કે.એન. પ્રશાંતના અને પૂર્વ જિલ્લા ન્યાયાધીશ આર.
 નટરાજનનું કે જોઓ કેરળ ન્યાયિક અકાદમીના પૂર્વ ડિરેક્ટર
 હતા તેમનું માળંદરન આશીરવાંદ્રાય સાભિત થયું. કમન્સીબે
 જ્યારે તેઓએ પરીક્ષા પાસ કરી હતી ત્યારે નટરાજનનું અવસાન
 થયું હતું, સિનિયર ટરક્ષીય સહકાર માટ્યો અને ન્યાયાધીશ સમક્ષ
 દાલીઓ કરવાની તક અપાવણ આવી હતી. તેના કરાણે તેમનો
 એ અભિવૃત્તા અનુભૂતિ હતી ગયો હતો.

आत्मावकाशस झूळ ज वधा गया हता।
 वकील तरीके नोंपायामा दोढ वर्षमां ज केरण न्यायिक सेवानी परीक्षामां भीजो कम मेजवाहो एवं अवैष्व वस्तु हती जेनी तेषो क्यारेय अपेक्षा नहोती करी। तेमनु लक्ष्य परीक्षा पास करवानु अने नोंदरो मेजवानु थुँ, आ तेमाहो बीजे प्रयास हठो अने तेषो प्रथम प्रयासमां पटभो रेन्क मेजव्यो हठो अने ते मुख्य परीक्षा पास करी शक्या न हता। जुनियर वकील तरीकेनी आवक खर्चने पडेवी वजाया माटे पूर्ती न होवाथी, तेमधे क्षयादाना विधायीओने टुक्रान अप्रयासनु शृङ कर्कु, तेमने न्यायिक सेवानी परीक्षाओनी तेवारी करवामां मद्द करता हता, ज बदलामां तेमनी पोतानी तैयारीओमां पश मद्द करी। यासीने एक नज़कना मित्रो उडो आलार व्यक्त कर्फे जेणो तेना संवर्धना समयमां तेने आर्थिक रीते टेको आयो।

તેઓ યાદ કરે છે કે, અભ્યાસ સાથે તેઓ જોમેટોમાં ડિવિવરી બ્યુથ તરીકે કામ કરતા હતા. તેઓને કોવિડ દરમયાન કામ બંધ રાખવું પડતું હતું અને નાણાની જરૂરીયાત હતી. ત્યારે તેમણે પરંનલ લોન માટે પ્રયત્ન કર્યા પરંતુ મળી નહોતી. પરીક્ષાઓ નજીક આવી રહી લાગાથી તેઓ બાળું કામ પણ કરી શક્યા નહોતે. હજ તરીકે તેઓને ખ્યાલ આવે છે કે તેમના નજીકના મિત્ર, અંચિઠા જેવા ઘણા લોકોએ તેમને તેમના અલાદેલાલી દરમયાન મુશ્કેલ સમય વાર કરવાની મદદ કરી હતી. તેમના મદદથી તેઓ ગાંધીયી શક્યા હતા અને ગાંધીયીની વૈગણી દી

શક્તિ હતા. સમગ્ર સંઘર્ષ દરમિયાન તેમના સમર્થને મને તે પડકારોમાંથી પસાર થવામાં મદદ કરવામાં નિર્ણયિક ભૂમિકા મજૂવી હતી।

तेमधी अन्यासानी पद्धति बेर एकोडस अने केस कायदाओं वाच्यवा अने समज्वा किंवा मूँझभूत बाबते पर ध्यान केन्द्रित कर्कायाणी हटी. तेमधी तेमधी तयारी अने संख्योक्त मात्रे KHC, Live Law द्वारा प्राप्त स्टडी मिटिरीयलसगो संदर्भ आण्यो. नेहो उल्लेख कर्यो छे के ते अन्य लोकोने प्रेरक टिप्स आपावामां मानता नाथी, परंतु निश्चितपणे माने छे के सजल महेन्त आणरे कण आपे छे. यासीन कहे छे, “जो तमारे लोनी परीक्षामांसकळ थांवु लोय तो युक्तिशास्त्रावाच्यवा आठावे. विषयाच्युं व्हाण राहो. मने नथी लागेतु के कोणी शोर्टटट छे. वधु ने वधु कुरुतुअो वांचावाने बदल तम्ही की वांच्यु छे तो समजावाना प्रयास करुता. मारा माटे मेरन्सानी परीक्षा सोशी अवधी रहती. विषयाच्युं KMCQ पर आवारित लोव्हीया, मने तेमां लायकात मेगवानांनो विश्वास अने माझो नक्काश मध्ये अंगेज लाभ अने माझे

વિવાહ હતા. મારા સુધી અગ્રજી ભાવ હતા. મુજબ
માટે, પેપર I અંગેજ હતું. હું માયલાય માયમાની શાળામાં
અજો હતું. મારા માટે તો મુખેલ હતું. બીજી મુખેલી સતત
દ્વારા સમાચાર હતું. ૧૨ કલાક લખવાની હતી. ઠનનથ્યું માટે
યાંચ સભ્યોની પેનલ છે અને અભાસની કોર્ટિયા શૉર્ટેક્ટ
પદ્ધતિઓ અપનાવિને ઠનનથ્યુમાં તમામ પ્રશ્નોના જવાબ આપી
કરતા નથી. તેથી વધુ ઊપરાખમાં વાંચો, વડીલ તરફે પ્રેક્ટિસ
કરો અને વ્યવહારિક સંદર્ભમાં વસ્તુઓને સમજાવાનો પ્રયાસ
કરો. તે સિવાય, મને નથી લાગતું કે ત્યાં કોઈ શૉર્ટેક્ટ છે.”
તો મિત્રો આ હતી ડિલિવરી બોયમાંથી ન્યાયાધી જેવા
પતિષ્ઠિત પદ સુધી પણોંનાર યાસીનાભાઈની તો મિત્રો તમને
દેનાના જીવનથી અનેક પ્રેરણા મળશે. ઓલ ધ બેસ્ટ.

આણવા જોવો છે કેમ કે એ ખોરાક-આહારનો ભાગ બજવે છે. વર્તમાન જિંદગીનો સાથો ખોરાક-આહાર છે, જ્યારે મૂત્રકણ કે બધિયા, એ તો એ ખોરાકમાં ટેમપરરી ટેસ્ટ રૂતો જ ભાગ બજવે ! મસાલાને ખોરાક ન બનાવાય, મારે પડે !

છોટન ક્રાચેય સિત કરવાનું શીખવાડવાનું ના હોય.
એ તો પ્રસાન્તાનાં સ્પર્શ થતા જ સિત કરવા માટે !
છેદજિને પણ ‘લાઈફ’ રહેવાનું શીખવાડવાનું ન હોય, એ
વે તરમાનોને સખ વેંટે જ ‘લાઈફ’ બની જય ! માત્ર
લાઈફ’ નું હોવું એજ મહદવાન નથી. લાઈફનું કણે કણે -
પત્રક કણે - ‘લાઈફ’ રહેવે એનું જ મહય છે. મોતાબાળના
નેકો આજે ‘જવતા’ છે, પણ ‘લાઈફ’ નથી, જીવત નથી.
‘જવતા’ હોવું અને ‘જવત’ હોવું - આ બંને સ્થિતિમાં ફરક
કરત. તરમાન આપણને ‘જવત’ રાપે છે. આવો જીવત-લાઈફ-

માણસ જ કિંગડળના રસને ભરયું શીતે માણી શકે !
 જે માણસ પોતાના શાસમાં ભગવા આવેલા વર્તમાનને
 બેમ નથી કરતો અને માત્ર જીવાની ગૈયેલા સમયને
 તુંહારું રહે છે એના વિચારો ઘરડા બની જ્યા છે. વિચાર
 કર્યાને વરડો તું તારે એ કાંઈ લાય છે. વિચાર બેખરે
 વૃદ્ધ બનાતો જોઈએ. 'વૃદ્ધ' એટે વૃદ્ધિવાળો. જેણ વિચારો
 તુંતું વૃદ્ધ પામતા રહે એ સાચો વૃદ્ધ. ઘરડા વિચારને તમે
 એ અંદિની શરીર કરો. પણ ક્યારેક તો એ ડાઈ આંખી

ને કરતું, પણ જીવાટ તો આ રહ્યું જો જીવાટ
પદવાળી જ છે. વિચાર પાડાણે ગઈ તો કથ્યું કાલ્પનિક
સ્તરી કરતો, છતાં કેટલાક લોઙો પોતાનાં વિચાર અને
જીવાણે ધ્યાય કે કલર કરવાનો પરિશ્રમ કરતા રહે છે. આવો
એ પરિશ્રમ 'વર્તમાનને ઓળખાવા' માટે કર્યે હુંત તો
બેમની આપ્યી જિંદગી પ્રસન્નતાનો પ્રવાહ બની શક !

૨૦૧૪ને અલવિદા કહેવાનો બદલે માત્ર સંતક કરીએ,
નેણ આવી રહેલા ૨૦૧૩ને સિમ્બુર્ક વેલકમ કરીએ એમાં
એ વર્તમાનની પ્રસન્નતા જ્ઞાનવિષય ! 'જગ્યુતી' પણ દેખે છે :

“છાંયડાને માપવાનું આજીવી તું બંધ કર,
આમ તો એ છાંયડો તડકાને લીધે હોય છે !”
:::: ટહુકો ::::
ઉમ્ર જલવોં મેં બસર હો યે જરૂરી તો નહીં,
હર શાલે ગમકી સહર હો યે જરૂરી તો નહીં;
- ખામોશ ગાણ્યુદ્ધી

ઇંયડાને માપવાનું આજથી તું બંધ કર,
આમ તો એ ઇંયડો તસ્કાને લીધે હોય છે;



કોઈનો થયો નથી અને થવાનો નથી.' પણ વાસ્તવિકતા તો કંઈક જુદી જ છે. સમય, દર્કનો છે. સમય દર્ક પાંચ છે. ફરક એટલો કે કોનો સમય ક્યારે પાક છે એને પાક રૂપે એને ક્યારે મળે છે! ભેતરાનું ઉંગલો-લિંગલો મખલખ કાપ આપણા વરસા અને ગોડાઊઓમાં આવે છે, એ અની વાવળી કર્યાની બીજી જ કણી નથી આવ્યો... ડેરીનો કાર, ગરામીનો ત્રાસ અને પોથેમાર વરસતા વરસદાનો માર સહન કરે છે, એ સંઘર્ષાંમાં પાડે છે તારે એ આવે છે. સમય પણ પાકતો હોય છે. સમય જ્યારે પાડે છે તારે આપણે હરખથી એવું બોલીએ છીએ કે : હવે અમારો સમય ઉજણો આવ્યો છે!

समय डेंगेशा उज्जो होय छे, पशा आपाणे अने ओगाझी शकता नाही. आपाणे व्यक्तित्वे, पसुन्हे, समग्र ज्ञवस्यूटिने उंभरना मापाचा भाषात रहीली थांगे. समयने वय कि उंभरो धाव लागे नाही. समयना प्रकार न होय, प्रकार विद्याराजना होय. समयने बद्धावानुन न होय, बद्धावानुन केंद्रावानुन होय. समय तो खस लाये छे. समय माटे 'अे हातो' कि 'हाशे' एवो शब्दध्येयोग पश्च न कराय. समयने भूतकाळा के भविष्यकागाना भंडिकायामां पूराय नाही. समय तो वर्तमानानुन ज वेंतु वडेखाली छे. समय तो सांप्रतनो

પ્રવાહ છે. આપણે શાસ લઈએ છીએ વર્તમાનનો અને પડણાયા વજાંબે હીએ ભૂતકાળના. આપણે વૃષ્ટિ વાયુથી છે વર્તમાનનું અને અની નીચે ધ્યાંડો શોભિએ હીએ બીજખણનો. ઘિયાળના લોકની જેમ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે જુલાત રહીએ છીએ. વર્તમાનો વિસ્તારો આપણને જાણે કે પત્તો જ નથી. વર્તમાન આપણને મળવા આવ છે, પણ આપણે અને આપણાથી જ દૂર...દૂર નથી, અનામાં ભગતા જ નથી અને આપણાથી જ દૂર...દૂર વાયુથી ગંભીર છે એવા ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ, તો ક્યારેક આપણે અજ વર્તમાન, આપણને મળવા જિંદગીના દરવાજે દસ્તક મારી રહ્યો છે એને અવગાણિન, જે હજુ સુધી આપણને મળવા

આયું જ નથી અને આવશે પણ નહીં, એવા ભવિષ્યની રાહ એલેઈ રહા છીએ અને પેલો વર્તમાન લીધારો ક્યારો દસ્તક દર રહ્યો છે એને નજરાંદાજ કરીએ છીએ !

જિદ્ગી જીવનનો સાચો આનંદ તો વર્તમાન સાથેની વિદ્યાર્થીનો છે. એંધે પોતાના વર્તમાન સાથે યોગી સી પણ બેંફાઈ કરી એંધે જિદ્ગીનો ચારુ ગુમાવ્યો છે એમ જ્ઞાયું ભૂતકાળનો સ્વાદ પિયરમિન્ટની જેમ અમૃત સમય પૂરતો-અમૃત કણ્ણો પૂરતો મળમાવવામાં છે. વર્તમાનનો સ્વાદ

